



### COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં એપ્રિલ 4 થી અમલી બનતા બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સર્વિસમાં ફેરફારો

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 2, 2020) – COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં અને બ્રેમ્પટન ટ્રાન્ઝિટ પોતાના સમુદાયને સુરક્ષિત રીતે સેવા આપતી હોવાની ખાતરી કરાવવા, નીચેની અઠવાડિક રજાની બસ સર્વિસમાં ફેરફાર, એપ્રિલ 4 થી અમલમાં આવશે:

નીચે જણાવેલા રૂટ્સ પર અસર પડશે.

#### શનિવાર:

- 32 ક્લાઇર ટોબિન – સર્વિસ રદ; સોમવાર-શુક્રવાર સંચાલન ચાલુ રહેશે
- 33 પીટર રોબર્ટસન – સર્વિસ રદ; સોમવાર-શુક્રવાર સંચાલન ચાલુ રહેશે
- 56 કિંગનોલ – સર્વિસ રદ; સોમવાર-શુક્રવાર સંચાલન ચાલુ રહેશે
- 52 મેકમર્થી – ઉપલબ્ધતા ઘટાડીને આખો દિવસ દર 50 મિનિટની કરવામાં આવી

#### રવિવાર:

- 32 ક્લાઇર ટોબિન - સર્વિસ રદ; સોમવાર-શુક્રવાર સંચાલન ચાલુ રહેશે
- 56 કિંગનોલ - સર્વિસ રદ; સોમવાર-શુક્રવાર સંચાલન ચાલુ રહેશે
- 52 મેકમર્થી – ઉપલબ્ધતા ઘટાડીને આખો દિવસ દર 50 મિનિટની કરવામાં આવી

અમે ઉતારુઓ વચ્ચે શારીરિક અંતર રાખવાના આચરણોને ટેકો આપવા બસ પર ઉતારુઓની ભાર ક્ષમતા અડધી બેઠક જેટલી સીમિત કરવાનું ચાલુ રાખ્યું છે ત્યારે, બ્રેમ્પટન ટ્રાન્ઝિટના કેટલાક બહુ વ્યસ્ત રૂટ્સ પર વધારાના સંસાધનોની ફાળવણી ફરીથી કરવાના હેતુસર આ ફેરફારો કરવામાં આવશે.

વધારે સારી સફાઈ અને સ્વચ્છતા (સેનિટાઈઝિંગ) સમયપત્રક અમલમાં રહે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય તમામ સખત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકોને દર 48 કલાકે ચેપરહિત કરવાનું છે. બસોને હાલમાં દર 24 કલાકે સેનિટાઈઝ કરવામાં આવે છે. સખત સપાટીઓ ધરાવતી સગવડો અને ટર્મિનલ્સને રોજંદા ધોરણે સાફ અને સેનિટાઈઝ કરવામાં આવે છે. ઉતારુઓને પ્રવાસ કરતી વખતે પોતાના અંગત ડિસઇન્ફેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનિટાઈઝર કે વાઈપ્સ સાથે રાખવા, અને પોતાના હાથ અવારનવાર ધોવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

સીટી ઓફ બ્રેમ્પટન જોખમો પર દેખરેખ ચાલુ રાખવા પીલ પબ્લિક હેલ્થ અને બ્રેમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસમાંના પોતાના ભાગીદારો સાથે ઘનિષ્ઠપણે કામ કરી રહ્યું છે. અદ્યતન માહિતી નિયમિત મેળવવા વેબસાઈટ [www.brampton.ca/covid19](http://www.brampton.ca/covid19) અને [www.bramptontransit.com](http://www.bramptontransit.com) જોતા રહો અથવા સર્વિસ અપડેટ્સ માટે Twitter પર @bramptontransit ને અનુસરો. કોઈ પ્રશ્નો સીધા બ્રેમ્પટન ટ્રાન્ઝિટના સંપર્ક કેન્દ્રને 905-874-2999 નંબર પર પૂછી શકાય છે.



# BRAMPTON

## Service and Information Update

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

### મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)